



**GUJARAT URBAN CO-OPERATIVE BANKS FEDERATION**  
Co-operative Banks Bhavan, Near Jaihind Press, Ashram Road, Mithakhali Under Bridge, Ahmedabad-380009.  
Phone : 079-26589159, 26589179, Fax : 079-26584901 E-mail : gujfed@gmail.com, Web : www.gujfed.com



પ્રેસનોટ

નાના અને મધ્યમવર્ગના લોકોના પુનરુત્થાન માટે "સરકાર" સાથે હાથ મિલાવશે  
"સહકાર"

ગુજરાત ફરીથી આત્મનિર્ભર બનશે નવા આર્થિક જોમ અને જુસ્સા સાથે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈની "આત્મનિર્ભર ભારત"ની હાકલના પ્રતિસાદ રૂપે અને કોરોના સામેના યુદ્ધમાં ગુજરાત સફળતાથી બહાર નીકળે, આત્મનિર્ભર બને તે માટે ગુજરાતના મુખ્યમંત્રી માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત યોજનાની ઘોષણા કરી છે.

નોવેલ કોરોના વાઈરસ (COVID-19)ની પરિસ્થિતિમાં આર્થિક મુશ્કેલી અનુભવી રહેલા નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યક્તિઓ, વ્યક્તિગત કારીગરો, શ્રમિક વર્ગને બિન તારણ ધિરાણ ઉપર વ્યાજ સહાય માટે 'આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના' જાહેર કરવામાં આવે છે.

ગુજરાતની 218 જેટલી સહકારી બેંકો, ૧૮ જિલ્લા સહકારી બેંકો સાથે મળીને લગભગ ૨૪૦૦ જેટલી શાખાઓમાંથી અને ૬,૦૦૦ જેટલી ક્રેડિટ સોસાયટીના માધ્યમથી નાના માણસોને લોન મળી રહે તે માટેનું આયોજન રાજ્ય સરકારે કરેલ છે. જે તમામને હાલમાં સહકારી બેંકો ૧૨ થી ૧૩ ટકા ના દરે લોન આપે છે,





## GUJARAT URBAN CO-OPERATIVE BANKS FEDERATION

Co-operative Banks Bhavan, Near Jaihind Press, Ashram Road, Mithakhali Under Bridge, Ahmedabad-380009.  
Phone : 079-26589159, 26589179, Fax : 079-26584901 E-mail : gujfed@gmail.com, Web : www.gujfed.com



--2--

તેની સામે ફક્ત આઠ ટકાના દરથી લોન ઉપલબ્ધ કરાશે. રાજ્ય સરકાર તેમાં છ ટકાની સબસિડી આપશે. જેના પરિણામે ધિરાણ મેળવનારને નેટ ૨% વ્યાજદરે લોન મળી રહેશે. આ સ્કીમ રાજ્ય સરકારની સાથે મળીને ગુજરાતના સહકારી ક્ષેત્રના આગેવાનો અને બેંકોના ચેરમેન અને અધિકારીઓ સાથે મળીને ઘડી કાઢી છે. સહકારી બેંકો જ્યારે જ્યારે દેશને કે રાજ્યને મુશ્કેલી પડે છે, જનતાને તકલીફ પડે છે, ત્યારે ખરે વખતે લોકોની વચ્ચે રહીને તેમની વહારે ધાય છે. હાલની કટોકટીમાં, મુશ્કેલ સમયમાં ગુજરાતના લોકો આર્થિક ક્ષમતા ફરી હાંસલ કરે, આત્મનિર્ભર બને તે માટે સરકાર અને સહકાર સાથે મળીને આ યોજનાનો અમલ કરશે. ગુજરાત અર્બન કો ઓપ બેંક્સ ફેડરેશનના ચેરમેન શ્રી જ્યોતીન્દ્ર મહેતા જણાવે છે કે સહકારી ક્ષેત્ર માટે ગૌરવની વાત છે કે ખરા સમયે જ્યારે ગુજરાતને જરૂર છે ત્યારે, ગુજરાતના વેપારીઓને જરૂર છે ત્યારે, નાના લોકોને જરૂર છે ત્યારે, તેમની પડખે મજબૂતીથી ઊભા રહેશે.

આ યોજનાનો લાભ ૧૦ લાખ લોકોને મળશે. બેંકો માત્ર અરજીના આધારે લોન મંજૂર કરશે. ૧ લાખ સુધીની લોન આગળ જણાવ્યું તેમ માત્ર ૨ % ના વાર્ષિક વ્યાજદરથી મળશે. પ્રથમ ૬ માસ વ્યાજ અને મુદ્દલ ચુકવવાની જરૂર નહિ હોય. લોન લેનારે કોઈ પ્રકારનો પ્રોસેસિંગ ચાર્જ ભરવાનો થશે નહિ. સહકારી ક્ષેત્ર સમાજના આર્થિક પુનરુત્થાનમાં ભાગીદાર બનવાની તક મળવાથી ખુશી અનુભવે છે.